


**MINISTRY OF FINANCE, DEPARTMENT OF FINANCIAL SERVICES**  
**BEFORE THE RECOVERY OFFICER,**  
**DEBTS RECOVERY TRIBUNAL-II**  
3rd Floor, Bhikhubhai Chamber, Opp. Deepak Petrol Pump, Ellisbridge, Ahmedabad-380006.

**(under Section 25(a) of Recovery of Debts due to Bank and Financial Institutions Act, 1993)**

RC/RP No.	13/2015	OA. No.	181/2013
Punjab National Bank		Certificate Holder Bank/FI	
VS			
Sant Kabir Tex & Ors.		Certificate Debtors	

**THROUGH PAPER PUBLICATION**  
**To.**  
**C.D. No. 1 :** Sant Kabir Tex, Through Partner, J-406, Japan Market, Ring Road, Surat.  
**C.D. No. 2 :** Shri Pravinbhai Shingala : Partner of sant kabir Tex, R/o 46, Sahaj Park Society, AK Road, Surat.  
**C.D. No. 3 :** Shri Bharatbhai Kashywal, Partner of sant kabir Tex, R/o 154, Vikram Nagar, Society, LH Road, Surat.  
**C.D. No. 4 :** M/s Shree Impex : 104, Rajhans Point, Varachha Main Road, Surat.  
**WHEREAS** Sant kabir Tex & Ors. have failed to pay sum of **Rs. 3,18,64,442/-** alongwith further interest @12%, in respect of certificate RP/RC No. 13/2015, dated 08/01/2015 issued by the Hon'ble Presiding Officer Under Section 19 (22) of the Recovery of Debts due to Banks and Financial Institution Act, 1993 and forwarded to the undersigned for execution.  
**YOU** (CDs No. 1 to 4) are hereby directed to appear in person before this Tribunal on **14/09/2017 at 11.30 AM** to show cause under Section 25(a) of the Act, as to why the under mentioned personal immovable properties should not be attached and sold in order to recover the outstanding dues under this Recovery Certificate.  
**DESCRIPTION OF PROPERTY**  
46, Sahaj Park Society, AK Road-Surat belong to CD No. 2  
154, Vikram Nagar, Society, LH road, Surat, belong to CD No. 3.  
**YOU** (CDs No. 1 to 4) are further directed to file reply, if any, within a period of 15 days from receipt of this show cause notice and maintain the status quo pertaining to the aforesaid properties and not part with the possession of the concerned property, in any manner, without specific permission of this Tribunal.  
**TAKE NOTE** that if you (CDs No. 1 to 4) fail to appear/show cause on the next date, the issue shall be decided in your absence without any further opportunity.  
Issued under my hand and seal of this Tribunal on this 31/08/2017



**JAI SING**  
**RECOVERY OFFICER -II**  
**Debts Recovery Tribunal-II, Ahmedabad.**

Notice under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (The Act)				
Sr. No.	Name and Address(es) of Borrower(s) (A)	Loan amount (Rs.) (B)	Particulars of Mortgaged Property / Properties (C)	Outstanding amount (Rs.) (D)
1.	<b>MR. / MRS. 1. SUTHAR NARENDRA J PROPRIETOR M/S. PRABHAT BATTERIES 2. SUTHAR TEJASH N 3. SUTHAR VAIBHAVKUMAR NARENDRABHAI 4. SUTHAR KAVITA TEJASKUMAR</b>  <b>All At:</b> M/S. PRABHAT BATTERIES GF-1, PRABHAT KOUJE OPPOSITE GOPAL PALACE HOTEL NEAR NAVKAR PETROL PUMP SARKHEJ-BAVALA N.H. 8-A ROAD NEAR SANATHAL CIRCLE, SANATHAL AHMEDABAD – 382210, GUJARAT.  <b>All Also At:</b> 203, RAJVI PEARL NEAR GURUDWARA S. G. ROAD BODAKDEV AHMEDABAD – 380054, GUJARAT.  <b>All Also At :</b> UNIT NO.704, 7TH FLOOR, BLOCK E, SILVER CASA, BEARING SURVEY NO.113/2 FINAL PLOT NO.6 B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD – 380054, GUJARAT.  <b>All Also At :</b> UNIT NO.705, 7TH FLOOR, BLOCK E, SILVER CASA, BEARING SURVEY NO.113/2, FINAL PLOT NO.6 B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD – 380054, GUJARAT.	Loan Account No. HHEAHE000261290 for an amount of <b>Rs.38,10,000/- (Rupees Thirty Eight Lakhs Ten Thousand Only)</b>	<b>Property being –</b>  PROPERTY NO. 1 - UNIT NO. 704, 7TH FLOOR, BLOCK E, SILVER CASA, BEARING SURVEY NO. 113/2, FINAL PLOT NO. 68, B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD – 380054, GUJARAT AND PROPERTY NO. 2 - UNIT NO. 705, 7TH FLOOR, BLOCK E, SILVER CASA, BEARING SURVEY NO. 113/2, FINAL PLOT NO. 68, B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD – 380054, GUJARAT  [more particularly described in SCHEDULE-A attached hereto]	<b>Rs.40,76,192/- (Rupees Forty Lakhs Seventy Six Thousand One Hundred Ninety Two Only)</b> as on <b>24.08.2017</b> along with future interest @ <b>11%</b> per annum w.e.f. <b>25.08.2017</b> till actual date of payment.

That the above named borrower(s) have failed to maintain the financial discipline in loan account and as per the books of accounts maintained in the ordinary course of business by the Company, there exists an outstanding amount indicated in column D against the name of each borrower(s).

Due to persistent default in repayment of the Loan amount on the part of the Borrower(s) the loan account of the Borrower(s) has been classified by the Company as Non Performing Asset within the stipulated norms. Consequently notices under Sec. 13(2) of the Act were also issued to each of the borrower.

In view of the above, the Company hereby calls upon the above named Borrower(s) to discharge in full his/her liabilities towards the Company by making the payment of the entire outstanding dues indicated in Column D above including up to date interest, costs, and charges within 60 days from the date of publication of this notice, failing which, the Company shall be entitled to take possession of the Mortgaged Property mentioned in Column C above and shall also take such other actions as is available to the Company in law.

Please note that in terms of provisions of sub-Section (8) of Section 13 of the SARFAESI Act, "A borrower can tender the entire amount of outstanding dues together with all costs, charges and expenses incurred by the Secured Creditor only till the date of publication of the notice for sale of the secured assets(s) by public auction, by inviting quotations, tender from public or by private treaty. Further it may also be noted that in case Borrower fails to redeem the secured asset within aforesaid legally prescribed time frame, Borrower may not be entitled to redeem the property."

That please be informed that the Borrower(s) are hereby restrained from alienating (including by way of transfer, sale, lease or otherwise) or creating third party interest or dealing with the Mortgaged Property in any manner except with specific prior written permission from Company. Be informed that any contravention thereof shall be punishable with imprisonment upto a period of one year or with fine or with both.

**SCHEDULE-A**  
**[Description of the Secured Asset]**  
**PROPERTY NO.1**  
**UNIT NO.704 ADMEASURING 57 SQ. YARDS I.E. 47.6589 SQ. MTRS. (BUILT UP AREA)**  
**ON 7TH FLOOR OF BLOCK "E" SITUATED IN THE BUILDING KNOWN AS "SILVER CASA" TOGETHER WITH 17 SQ. MTRS., UNDIVIDED AND UN-DEMARCATED SHARE, FORMING PART OF FREEHOLD NON-AGRICULTURAL LAND SITUATED AT MOUJE THALTEJ OF GHATLODIA TALUKA IN THE DISTRICT OF AHMEDABAD AND REGISTRATION SUB-DISTRICT OF AHMEDABAD-9 (BHOPAL), BEARING SURVEY NO. 113/2 ADMEASURING 6070 SQ. MTRS., FINAL PLOT NO. 68 ADMEASURING 4299 SQ. MTRS., OF TOWN PLANNING SCHEME NO. 1 (THALTEJ) B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD.**  
**UNIT NO.704 IS BOUNDED AS FOLLOWS –**  
**ON OR TOWARDS THE EAST : UNIT NO. E/703**  
**ON OR TOWARDS THE WEST : UNIT NO. E/705**  
**ON OR TOWARDS THE NORTH : UNIT NO. E/707**  
**ON OR TOWARDS THE SOUTH : SOCIETY COMMON SPACE SOCIETY BOUNDARY**  
**PROPERTY NO.2**  
**UNIT NO.705 ADMEASURING 79 SQ. YARDS I.E. 66.05 SQ. MTRS., (BUILT UP AREA)**  
**ON 7TH FLOOR OF BLOCK "E" SITUATED IN THE BUILDING KNOWN AS "SILVER CASA" TOGETHER WITH 25 SQ. MTRS., UNDIVIDED AND UN-DEMARCATED SHARE, FORMING PART OF FREEHOLD NON-AGRICULTURAL LAND SITUATED AT MOUJE THALTEJ OF GHATLODIA TALUKA IN THE DISTRICT OF AHMEDABAD AND REGISTRATION SUB-DISTRICT OF AHMEDABAD-9 (BHOPAL), BEARING SURVEY NO. 113/2 ADMEASURING 6070 SQ. MTRS., FINAL PLOT NO. 68 ADMEASURING 4299 SQ. MTRS., OF TOWN PLANNING SCHEME NO. 1 (THALTEJ) B/H. J. G. INTERNATIONAL SCHOOL, NR. GULAB TOWER, THALTEJ, AHMEDABAD.**  
**UNIT NO.704 IS BOUNDED AS FOLLOWS –**  
**ON OR TOWARDS THE EAST : UNIT NO. E/704**  
**ON OR TOWARDS THE WEST : SOCIETY COMMON SPACE, SOCIETY BOUNDARY**  
**ON OR TOWARDS THE NORTH : UNIT NO. E/706**  
**ON OR TOWARDS THE SOUTH : SOCIETY COMMON SPACE, SOCIETY BOUNDARY**

**For Indiabulls Housing Finance Ltd.**  
Authorized Officer



**RISHI LASER LTD.**  
CIN: L99999MH1992PLC066412  
612 V.K.Indl.Estate,10/14 Pais Street, Byculla (W), Mumbai 400 011  
Email: rld.mumbai@rishilaser.com  
Web: www.rishilaser.com


**CORRIGENDUM**  
In the Notice of 25<sup>th</sup> Annual General Meeting dated 27<sup>th</sup> June 2017 forming part of Printed Annual Report of the Company the serial no for the Special Business transacted be read as 4 instead of 1.



**Super Spinning Mills Limited**  
CIN:L17111TZ1962PLC001200  
REGD OFFICE: "ELGI TOWERS", PG. NO. 7113, 737-D, GREEN FIELDS, PULLAKULAM ROAD, COIMBATORE - 641 045.  
**NOTICE**  
Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Monday, the 11th September 2017 inter alia to approve the Unaudited Financial Results of the Company for the quarter ended 30th June 2017.  
The said Notice may be accessed on the Company's website at [www.superspinning.com](http://www.superspinning.com) and may also be accessed on the stock exchange website [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).  
  
For Super Spinning Mills Ltd.,  
**Ramaa Krishnakumar**  
Coimbatore  
01.09.2017  
Company Secretary



**RAJA BAHADUR INTERNATIONAL LIMITED**  
Regd. Office: Hamam House, 3<sup>rd</sup> Floor, Ambalal Doshi Marg, Fort, Mumbai – 400001.  
CIN: L17120MH1926PLC001273  
Tel No. 022- 22654278,  
Fax: 022- 22655210  
e-mail id: investor@rajabahadur.com  
website: [www.rajabahadur.com](http://www.rajabahadur.com)  
Pursuant to the Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Thursday, 14<sup>th</sup> September, 2017, inter alia, to approve the Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter ended June 30, 2017.  
The notice of board meeting is uploaded on the website of the company at <http://www.rajabahadur.com/nac.php> and also on the website of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com).  
For and on behalf of the Board  
**Raja Bahadur International Ltd.**  
Sd/-  
**Rohit Taparia**  
Company Secretary  
ACS-35756  
  
Place: Mumbai  
Dated: September 06, 2017



**MONARCH CAPITAL**  
*—wealthcare redifined—*

**MONARCH NETWORKTH CAPITAL LIMITED**  
(Formerly known as Networth Stock Broking Limited)  
CIN: L65920MH1993PLC075393  
Regd. Office :901/902, 9th Floor, Atlanta Centre, Sonawala Lane, Opp. Udyog Bhavan, Goregaon (East), Mumbai-400063  
Tel No. 022 3064 1600; Fax No. 022 2685 0257;  
Email: reachus@mncdgroup.com; Website: [www.mncdgroup.com](http://www.mncdgroup.com)

**Extract of Standalone Un-Audited Financial Results for the Quarter ended 30th June, 2017**  
(Rs. in Lakhs except no. of shares & EPS)

Sr. No.	Particulars	Quarter Ended			
		30.06.2017 (Unaudited)	31.03.2017 (Audited)	30.06.2016 (Unaudited)	31.03.2017 (Audited)
1.	Total Income from operations (net)	1565.55	1,461.39	1,159.49	5,409.84
2.	Net Profit / (Loss) from ordinary activities after tax	243.26	138.16	190.85	731.09
3.	Net Profit / (Loss) after taxes (after Extraordinary items)	243.26	138.16	190.85	731.09
4.	Paid-up Equity Share Capital (Face Value of Rs. 10/- each)	3,031.16	3,031.16	3,031.16	3,031.16
5.i.	EPS (before extraordinary items)/( of Rs. 10/- each) (not annualised)	0.8	0.46	0.63	2.41
	(a) Basic	0.8	0.46	0.63	2.41
	(b) Diluted	0.8	0.46	0.63	2.41
5.ii.	EPS (After extraordinary items) ( of Rs.10/- each) (not to be annualised)	0.8	0.46	0.63	2.41
	(a) Basic	0.8	0.46	0.63	2.41
	(b) Diluted	0.8	0.46	0.63	2.41


**Notes:**  
The above is an extract of the detailed format of Quarterly Un-Audited Financial Results filed with Bombay Stock Exchange Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements Regulations, 2015. The full format of the Financial Results are available on the following weblinks:  
1) On the BSE Limited: <http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=511551&dur=A&expandable=0>  
2) On Company's website: <https://www.mncdgroup.com/investor-relation/investor-relation-financials-quarterly-results>

**By order of the Board of Directors**  
**For MONARCH NETWORKTH CAPITAL LIMITED**  
(Formerly known as Networth Stock Broking Limited)  
Sd/-  
**Vaibhav Shah**  
Chairman and Managing Director  
  
Place : Mumbai  
Dated : 04.09.2017




**SAMBHAAV MEDIA LIMITED**  
(CIN: L67120GJ1990PLC014094)  
Registered Office: Sambhaav House, Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015  
Phone: + 91 79 2687 3914/15/16/17 Fax: + 91 79 2687 3922  
Email: secretarial@sambhaav.com Website: [www.sambhaavnews.com](http://www.sambhaavnews.com)

**NOTICE**  
Notice, pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, is hereby given that a Meeting of Board of Directors of the Company will be held on Thursday, September 14, 2017 at the Registered Office of the Company to consider and approve the unaudited financial results for the quarter ended on June 30, 2017.  
  
*You may also refer the website of the Company at [www.sambhaavnews.com](http://www.sambhaavnews.com) and stock exchange(s) at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) for further details.*  
  
Date: September 07, 2017 For, **Sambhaav Media Limited**  
Place: Ahmedabad Company Secretary




**shri dinesh mills Ltd.**  
CIN: L17110GJ1935PLC000494  
P.B.No.2501, Padra Road, Vadodara – 390 020 Tel No. 0265 – 2330060 / 61 / 62,  
Fax No. 0265 – 2336195, Email: [sojitra@dineshmills.com](mailto:sojitra@dineshmills.com) Website: [www.dineshmills.com](http://www.dineshmills.com)

**NOTICE**  
Members of the Company are hereby informed that, the Company has completed the despatch of Notice of 82<sup>nd</sup> Annual General Meeting (AGM) to be held on Wednesday, 27<sup>th</sup> September, 2017 for transacting the business as stated in the Notice dated 30<sup>th</sup> May, 2017 and other particulars pursuant to Regulation 44 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014 are furnished below:  
1. Date of completion of dispatch of Annual Reports including the Notice of 82<sup>nd</sup> AGM: 1<sup>st</sup> September, 2017 by electronic mode and 2<sup>nd</sup> September, 2017 by physical mode.  
2. Date & time of commencement of remote e–voting: 24<sup>th</sup> September, 2017 at 09.00 a.m.  
3. Date & time of end of remote e–voting: 26<sup>th</sup> September, 2017 at 5.00 p.m.  
4. E–voting by electronic mode shall not be allowed beyond 5.00 p.m. on 26<sup>th</sup> September, 2017.  
5. The Annual Report for the year 2016–2017 including Notice of the 82<sup>nd</sup> AGM and procedure for e–voting has been sent to all the shareholders by prescribed modes and the same are also displayed on the website of the Company at the link <http://suiting.dineshmills.com/annual.php>  
6. Cut–off date for determining the voting rights is 20<sup>th</sup> September, 2017.  
7. Any person who becomes member of the Company after dispatch of the AGM Notice and holding shares on the Cut Off date may obtain the USER ID and password by sending request at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in) or [sojitra@dineshmills.com](mailto:sojitra@dineshmills.com). The members who have already exercised their votes by remote e-voting may attend the AGM but shall not be entitled to vote again. The facility for voting through Poll shall be made available at the AGM for those members who have not casted their votes by remote e-voting. The members who hold shares in physical mode can prefix 106990 with their folio no. as LOGIN ID and for Password, contact the Company to cast their votes electronically.  
  
For any queries /grievances connected with e–voting, members may refer to the Frequently Asked Questions (FAQs) for shareholders and e–voting user manual available at the Downloads Section of [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com)  
  
Mr. Kashyap Shah, Practicing Company Secretary, Email: [kashyap.cs@gmail.com](mailto:kashyap.cs@gmail.com) Phone No.(0265) 2362244 is appointed as Scrutinizer for conducting the e–voting process in a fair and transparent manner.  
  
For **Shri Dinesh Mills Ltd.**  
**J. B. Sojitra**  
Executive Director (Corporate Affairs) & Company Secretary  
  
Place : Vadodara  
Date : 6<sup>th</sup> September, 2017



**MUTUALFUNDS**  
*Sahi Haa*



**uti**  
UTI Mutual Fund

**Haq, ek behtar zindagi ka.**


**NOTICE**  
**UTI FIXED TERM INCOME FUND - SERIES XXVII - VIII (1117 DAYS)**  

NFO opens on	Thursday, September 07, 2017
NFO closes on	Thursday, September 21, 2017
Date of allotment	Friday, September 22, 2017
Maturity date	Tuesday, October 13, 2020


During the New Fund Offer, the units of the scheme will be sold at the face value of ₹10/- per unit.

**Mumbai**  
**September 06, 2017**  
**Toll Free No.: 1800 22 1230**  
**Website: [www.utimf.com](http://www.utimf.com)**

**For Existing Registered Investors**  




Type ESOA to 5607090 to request for Account Statement.\*



Type BAL <Folio no> to 5607090 to know your Folio Balance.\*

#Subject to Terms & Conditions

**The time to invest now is through - UTI SIP**  
REGISTERED OFFICE: UTI Tower, 'Gn' Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051. Phone: 022- 66786666. UTI Asset Management Company Ltd. (Investment Manager for UTI Mutual Fund) E-mail: [invest@uti.co.in](mailto:invest@uti.co.in) (CIN-U65991MH2002G01137867).  
For more information, please contact the nearest UTI Financial Centre or your AMFI/NISM certified UTI Mutual Fund Independent Financial Advisor, for a copy of Statement of Additional Information, Scheme Information Document and Key Information Memorandum cum Application Form.  
UTI-SIP is only an investment approach applied to various equity, debt and balanced schemes of UTI Mutual Fund (UTI MF) and is not the name of a scheme / plan of UTI MF.




**INSILCO LIMITED**  
(A Member of Evonik Industries Group)  
CIN: L34102UP1988PLC01041  
Regd. Office - A - 5, UPSIDC Industrial Estate, Bhartiagram, Gajraula, Distt. Amroha, U.P.-244223  
Phone: 0983723893, Fax: (05924) 252348, Email id: [insilco@evonik.com](mailto:insilco@evonik.com), Website: [www.insilcoindia.com](http://www.insilcoindia.com)  
Statement of Un-audited Financial Results for the Quarter/Three months ended 30<sup>th</sup> June 2017 (Rs. in Lakhs)

Particulars	Quarter ended	
	30/06/2017	30/06/2016
Total income from operations (net)	2,361	2,141
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	145	127
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	145	127
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	74	127
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	83	127
Equity Share Capital	6,272	6,272
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -		
(a) Basic	0.01	0.02
(b) Diluted	0.01	0.02

**Note:**  
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results alongwith Limited Review Report are available on the website of Stock Exchange ([www.bseindia.com](http://www.bseindia.com)) and the Company ([www.insilcoindia.com](http://www.insilcoindia.com)).  
2. The Company has adopted Ind AS (Indian Accounting Standards) w.e.f. 1<sup>st</sup> April, 2017. Accordingly, the relevant quarterly results for the previous period is restated.  
3. The reconciliation of net profit or loss reported in accordance with Indian GAAP to total comprehensive income in accordance with IndAS is given below:

Description	3 months ended June 30, 2016 (INR in lakhs)
<b>Net Profit/ (Loss) as per Previous GAAP (Indian GAAP)</b>	(21)
Add/Less :	
Fair value gain on investments	113
Effect of measurement of loans given to employees at amortised cost using effective interest rate	•
Finance lease	•
Depreciation and amortisation expense on capital spares	35
<b>Net profit/ (loss) as per Ind AS</b>	<b>127</b>
Other comprehensive income, net of income tax	-
<b>Total comprehensive income for the period</b>	<b>127</b>
* Amount below the rounding off norm adopted by the company.	
# The Company does not have any Exceptional and Extraordinary Items to report in above periods.	


**For Insilco Limited**  
Sd/-  
**Brijesh Arora**  
Managing Director  
DIN : 00952523



**JHAVERI CREDITS & CAPITAL LIMITED**  
CIN: L65910GJ1993PLC020371  
Reg. Office:- 301, Payal Towers-II, Sayajigunj, Vadodara-390020  
Website- [www.jhavericommodity.com](http://www.jhavericommodity.com), E-mail- [igc@jhaveritrade.com](mailto:igc@jhaveritrade.com), Contact no. 0265-2226201

**NOTICE**  
With Reference to our notice dated 23-08- 2017, Notice is hereby given that the 23<sup>rd</sup> Annual General Meeting of the Shareholders of the Company Jhaveri Credits & Capital limited will be held on Saturday, 30<sup>th</sup> September, 2017 at 11:00 a.m. at the registered office of the Company to transact the ordinary business, as set out in the notice of Annual General Meeting.  
As permitted under Rule 11 of the Companies (Accounts) Rules, 2014, the Annual Report of the Company for financial year 2016-17 have been sent through electronic mode to those shareholders who have registered their e-mail id with depositories and the physical copies were dispatched to other shareholders at their registered postal address by permitted mode.  
Pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by the Companies (Management and Administration) Amendment Rules, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is offering e-voting facility for transaction business through e-voting services provided by National Securities Depository Limited (NSDL). The Company is also offering the facility of Postal Ballot to the Members to cast their vote and also physical ballot at the AGM.  
In accordance with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, the Company has fixed 22<sup>nd</sup> September, 2017 as 'cut-off date' to determine the eligibility to vote by electronic means or in Annual General Meeting. A person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintain by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or voting in the Annual General Meeting.  
The remote e-voting period begins on 9:00 a.m. Wednesday 27<sup>th</sup> September, 2017 and ends on Friday 29<sup>th</sup> September, 2017 at 5:00 p.m. During this period the eligible shareholder of the company holding shares either in physical form or in dematerialized form, may cast their vote electronically. The e-voting module shall be disabled by NSDL for voting thereafter.  
The facility for voting, through ballot/polling paper shall also be made available at the venue of the AGM. The members who have already cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again at the AGM.  
Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the notice and holding shares as of the cut-off date i.e. 22<sup>nd</sup> September, 2017 may obtain the login ID and password by sending a request at [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in) or Issuer/RTA. However, if you are already registered with NSDL for remote e-voting then you use your existing user ID and password for casting your vote. If you forgot your password, you can reset your password by using "Forgot User Details/Password" option available on [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) or contact NSDL at the following toll free no.: 1800-222- 990  
NOTICE is also given under Section 91 of the Companies Act, 2013 that the Registered of Members and Transfer Books of the Company will remain closed from 22<sup>nd</sup> September, 2017 to 29<sup>th</sup> September, 2017 (both days inclusive) for the purpose of the Annual General Meeting.  
  
**for and on behalf of Board of Directors**  
**of M/s Jhaveri Credits & Capital Ltd**  
**Kamlesh J. Jhaveri**  
**Whole Time Director**  
**DIN:00266242**

**Place : Vadodara**  
**Dt : 04-09-2017**



**Bank of India**  
*Relationship beyond banking*

Head Office: Star House, C-5, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051.

**NOTICE**  
NOTICE is hereby given that pursuant to Regulation 57 of the Bank of India (Shares & Meetings) Regulation 2007, the Extra Ordinary General Meeting (EGM) of the shareholders of Bank of India will be held on **Thursday, 12th October 2017 at 10.15 A.M.** at Bank of India Auditorium, Star House, C-5, G-Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051 to transact the following business.  
To elect **TWO** Director from amongst the Shareholders of the Bank, other than the Central Government, in respect of whom valid nominations as prescribed have been received, in terms of Section 9(3)(i) of the Banking Companies (Acquisition and Transfer of Undertakings) Act, 1970 read with the Banking Regulation Act, 1949 and The Nationalised Bank (Management & Miscellaneous Provisions) Scheme, 1970 and Bank of India (Shares and Meetings) Regulations, 2007 made pursuant to Section 19 of the Act, and Notification issued by Reserve Bank of India and Guidelines issued by Government of India in this regard.  
**By order of the Board**  
Sd/-  
**(Dinabandhu Mohapatra)**  
**Managing Director & CEO**

**Place: Mumbai**  
**Date: 01.09.2017**  
**NOTES:**  
1. For this purpose, each shareholder who has been registered as a shareholder on the Specified Date i.e., on **Friday, the 8th September, 2017** will be entitled to participate (to nominate, contest and vote) in the Election of two Shareholders' Directors of the Bank (Elections) and shall have one vote for each share held by him/her as on the Specified Date to vote on the items on the agenda. However, no shareholder other the Central Government shall exercise voting rights in excess of 10% percent of the total voting rights of all the shareholders of the Bank.  
2. Individual notices will be sent to shareholders of the Bank whose names have appeared in the Register of Shareholders of the Bank as on Friday, 8th September 2017 either by email to the email ids registered with the depository or by Registered post/ Courier/ Speed post to the address registered with the Bank.  
3. Copy of the notice along with formats or Declaration Form, Nomination Form and Personal Declaration and Undertaking is also available on the website of the Bank viz. [www.bankofindia.co.in](http://www.bankofindia.co.in) together with Proxy Form, Attendance Slip and Entry pass. The shareholders may obtain the physical copy by writing to the Company Secretary at [headoffice.share@bankofindia.co.in](mailto:headoffice.share@bankofindia.co.in)  
4. Shareholders desirous of contesting the election of Director of the Bank from amongst the shareholders other than the Central Government should submit a minimum of 100 Valid Nomination Forms along with the declaration / bio data and other related documents in a sealed envelope to the Company Secretary on any working day not less than fourteen days before the date fixed for the EGM i.e. on or before 04.30 p.m. of Wednesday, the 27th September 2017.  
5. If only two valid nominations are received, then the Shareholders in respect of whom valid nominations (subjected to scrutiny of the Nomination Committee of the Board in terms of the Fit and Proper Guidelines of RBI and applicable Govt. of India Guidelines) shall be deemed to have been elected and in that event the EGM will not be conducted/held.  
6. The Bank has in terms of Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations provided remote e-voting facility to shareholders for the agenda to be transacted in the Extraordinary General Meeting. The details of process of e-voting is available to the shareholders in the Notice being dispatched / emailed to them.  
7. The remote e-voting period commences on 9th October 2017 (9:00 am) and ends on 11th October 2017 (5:00 pm).  
8. In case of any queries, contact E-Voting Team of NSDL at 1800222990 or [evoting@nsdl.co.in](mailto:evoting@nsdl.co.in)  
9. To enable shareholders who have not voted through the remote e-voting, the Bank will be conducting voting at the venue of meeting.  
10. The consolidated results of remote e-voting together with the voting held at the EGM will be announced by the Bank on its website and also informed to the stock exchanges as well NSDL.



વડોદરા શહેર / જિલ્લામાં મા નર્મદા મહોત્સવનો પ્રારંભ : નર્મદા રથ યાત્રાનું મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

# શહેર તથા જિલ્લામાં નર્મદા રથ પરિભ્રમણ કરશે

વડોદરા, તા. ૬ : ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા બંધના તમામ ૩૦ દરવાજા બંધ થતા હવે ગુજરાતના વિકાસના દ્વારા ખુલશે એટલું જ નહીં નર્મદા જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા કેમમાં પાણીની સંગ્રહ શક્તિમાં પોષા ચાર ગણો વધારો થશે એટલે કે ૧.૨૭ મિલિયન એકર

નર્મદા બંધના દરવાજા બંધ થતા ગુજરાતના વિકાસના દ્વારા ખુલશે — ખેલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી



વડોદરામાં વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મા નર્મદા મહોત્સવના શુભારંભ પ્રસંગે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટે તથા મહાનુભાવોએ વડોદરા શહેર તથા જિલ્લામાં પરિભ્રમણ કરનાર મા નર્મદા મહોત્સવના છ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મંત્રી તથા મહાનુભાવોએ મા નર્મદાની આરતી ઉતારી રથનું શાસ્ત્રોત વિધિપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું. વડોદરા



શહેરના તમામ વોર્ડ તથા જિલ્લાના ૪૮૪ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે. ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યું કે એનેક અવરોધો બાદ નર્મદા યોજના સાકાર થઈ છે, જેને પરિણામે ગુજરાત વિકાસની નવી ઉંચાઈએ હાંસલ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળવાના માત્ર ૧૭ દિવસમાં નર્મદા કેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપી હતી અને હવે દરવાજા મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નર્મદા યોજના સંપૂર્ણ રીતે સાકાર

થતાં ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચશે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા યોજનાને રાષ્ટ્રપ્રમુખ કરવાના છે, ત્યારે વડોદરા શહેર/ જિલ્લાના નાગરિકોને મા નર્મદા મહોત્સવમાં જોડાઈને નર્મદા રથના ગામડે ગામડે વધામણા કરવા ત્રિવેદીએ અનુરોધ કર્યો હતો. આ અવસરે સાંસદ રંજનબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને આ પ્રસંગે ધારાસભ્યો, તુડાના ચેરમેન, સ્ટેટ કુડ કમિશન અધ્યક્ષ, પદાધિકારીઓ, મ્યુ. કમિશનર, ડીડીઓ, નગરસેવકો સહિત નગરજનો હાજર રહ્યા હતા.



વૃંદાવન ખાતે શ્રાવણી પર્વની ઉજવણી

પૂ.જીજ્ઞા જામદિનીની ઉજવણીના ભાગરૂપે વૃંદાવન ખાતે આયોજીત શ્રાવણી પર્વ કાર્યક્રમ મધુરેશ્વરજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પૂ. વ્રજરાજકુમારજી, મોરારિખાપુ, સાદવી રતુભરા ઉપસ્થિત રહ્યા હતા.

## મ.સ.યુનિ.માં નેશનલ ન્યુટ્રીશન સમાહની ઉજવણીના ભાગરૂપે ફેકલ્ટી ઓફ ફેમિલી અને કમ્યુનિટી સાયન્સમાં ફુડ ફેસ્ટિવલ યોજાયો

વડોદરા, તા. ૬ : મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ફેમિલી અને કમ્યુનિટી સાયન્સ દ્વારા દર વર્ષે નેશનલ ન્યુટ્રીશન સમાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ફુડ અને ન્યુટ્રીશન વિભાગ દ્વારા ફેકલ્ટી ન્યુટ્રીશન વિભાગ દ્વારા ન્યુટ્રીવેટીક નામની બ્રાંડ બનાવવામાં આવી



ફેકલ્ટી ઓફ ફેમિલી અને કમ્યુનિટી સાયન્સ દ્વારા નેશનલ ન્યુટ્રીશન સમાહની ઉજવણીના ભાગરૂપે ફુડ અને ન્યુટ્રીશન વિભાગના પચ્ચીસ પ્રાધ્યાપકો અને ભસ્સો

વિદ્યાર્થીઓ દ્વારા ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનવના શરીરમાં જરૂરી ન્યુટ્રીશન પુરા પડતી વાનગીઓ બનાવવામાં આવી હતી. ફુડ અને ન્યુટ્રીશન વિભાગ દ્વારા ન્યુટ્રીવેટીક નામની પોતાનું બ્રાન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પચ્ચીસ વિદ્યાર્થીઓએ ભેગા થઈને ઈન્સ્યુલીનમાંથી ન્યુટ્રીશન મળે એવી વાનગીઓ બનાવી હતી, જેમાં ખાખરા, મલ્ટીગ્રેન ચેપલા, ચીકડી, મુઠીયા, હાંડવો સહિતની સામગ્રી બનાવી હતી. વિભાગના પ્રાધ્યાપક એવા કાંચી

## વેલનેસ ઈન્ફો કલબ દ્વારા કિડની હેલ્થ પર સેમિનારનું આયોજન

વડોદરા, તા. ૬ : વેલનેસ ઈન્ફો કલબ દ્વારા તા. ૧૦મીએ રવિવારે સાંજે કિડની હેલ્થ અને કિડની સંબંધિત રોગો પર આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વેલનેસ કલબના પ્રિયકાંત ભટ્ટ વિસ્તૃત માહિતી આપશે.

કિડની હેલ્થ પર આરોગ્ય સેમિનાર તા. ૧૦મી સપ્ટેમ્બરે ભરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે. સેમિનારમાં ભાગ લેનાર ઈચ્છુક લોકો વેલનેસ ઈન્ફો કલબ ભાવથી ખાતે નોંધણી કરાવી શકશે. આ સેમિનારમાં કિડની ડીઝીઝ, કિડની ડીઝીઝના લક્ષણો અને કારણો, કુદરતી અને ધરત્રી ઉપાયો, યોગ્ય ડાયેટ અને કયા ખોરાક ટાળી શકાય? શારીરિક અને કિડની હેલ્થ માટે યોગ્ય વ્યાયામ સહિતની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હેલ્થ એક્સપર્ટ પ્રિયકાંત ભટ્ટ હેલ્થ સંદર્ભે જરૂરી માહિતી સાથે હેલ્થી જીવન અંગેની ટીપ્સ તેમજ નિયમિત વ્યાયામ સંદર્ભે પણ વિસ્તૃત માહિતી આપશે.

## વડોદરામાં એરફોર્સ ભરતી મેળાનું આયોજન ભારતીય હવાઈદળમાં ભરતી માટે તા. ૧૮મીએ લેખિત પરીક્ષા લેવાશે

વડોદરા, તા. ૬ : ભારતીય હવાઈદળમાં એરમેનની ભરતી માટે સમા ઉંડોર સ્પોર્ટ્સ સેટિંગમ, વડોદરા ખાતે તા. ૧૮/૦૮/૨૦૧૭ના રોજ લેખિત કસોટી તથા તા. ૨૦/૦૮/૨૦૧૭ના રોજ શારીરિક કસોટી યોજાશે. એરમેન ભરતી રેલી-૨૦૧૭માં ઉમેદવારોએ સવારે ૦૬:૦૦ કલાકે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ભારતીય હવાઈદળમાં ગ્રુપ વાયની નોનટેકનિકલ ઓટોમોબાઈલ ટેકનિશિયન, ગ્રાઉન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટ્રુક્ટર, આઈ.એ.એફની જગ્યાઓ માટે ઉમેદવાર ધો-૧૨ કોર્પસ પ્રવાહમાં પ૦ ટકા સાથે અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ થયેલ

## યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

વડોદરા, તા. ૬ : મ.સ.યુનિ.ના એમ.કોમ.ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આઈ શિક્ષકોને મોમેન્ટો આપવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા લાડુ કપાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આયોજક કલ્યાણી પટેલે જણાવ્યું હતું કે ' શાળામાં ખુબ જ ઉત્સાહભરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ, તે વાતાવરણ કોલેજમાં નહિ જોવા મળતા હોવાની લાગણી અનુભવાય છે, જેના કારણે આજે આ ઉજવણી કરવામાં આવી હતી.

## ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળાને વર્ષ ૨૦૧૭નો શ્રેષ્ઠ શાળા એવોર્ડ

વડોદરા, તા. ૬ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૫મી સપ્ટેમ્બર ના રોજ સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે શિક્ષણદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમિતિની પ્રણાલિકા મુજબ પ્રતિવર્ષે નિવૃત્ત શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકો સન્માન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન શિક્ષક ભાઈ-બહેનો અને શાળાઓએ કરેલા શ્રેષ્ઠ કાર્યોને બિરદાવવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. મકરપુરા વિસ્તારમાં આવેલી ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળાને વર્ષ ૨૦૧૭નો શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેયર, સાંસદ ધારાસભ્ય સરકારના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સમિતિ ના ચેરમેન, વા. ચેરમેન મુકેશકુમાર દિલ્હી, શાસનાધિક, તેમજ પ.પૂ. ગો. ૧૦૮ દ્વારા કેશલાલજી મહારાજના હસ્તે એનાયત કરવામાં આવ્યો. શાળાના આચાર્ય કામિનીબેન પટેલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અમારી શાળાને પ્રાપ્ત થયો તે બદલ હું અને મારો શાળા પરિવાર શિક્ષણ સમિતિના વહીવટદારો અને પદાર્થ સર્વ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીએ છીએ.

**SAMBHAAY MEDIA LIMITED**  
(CIN: L67120GJ1990PLC014046)  
Registered Office: Sambhav House, Opp. Jaijag's Bungalows, Phandhargar Road, Sathliya, Ahmedabad - 380 015.  
Phone: +91 79 2853 3841/3842/3843/3844/3845/3846/3847/3848/3849/3850/3851/3852/3853/3854/3855/3856/3857/3858/3859/3860/3861/3862/3863/3864/3865/3866/3867/3868/3869/3870/3871/3872/3873/3874/3875/3876/3877/3878/3879/3880/3881/3882/3883/3884/3885/3886/3887/3888/3889/3890/3891/3892/3893/3894/3895/3896/3897/3898/3899/3900/3901/3902/3903/3904/3905/3906/3907/3908/3909/3910/3911/3912/3913/3914/3915/3916/3917/3918/3919/3920/3921/3922/3923/3924/3925/3926/3927/3928/3929/3930/3931/3932/3933/3934/3935/3936/3937/3938/3939/3940/3941/3942/3943/3944/3945/3946/3947/3948/3949/3950/3951/3952/3953/3954/3955/3956/3957/3958/3959/3960/3961/3962/3963/3964/3965/3966/3967/3968/3969/3970/3971/3972/3973/3974/3975/3976/3977/3978/3979/3980/3981/3982/3983/3984/3985/3986/3987/3988/3989/3990/3991/3992/3993/3994/3995/3996/3997/3998/3999/4000/4001/4002/4003/4004/4005/4006/4007/4008/4009/4010/4011/4012/4013/4014/4015/4016/4017/4018/4019/4020/4021/4022/4023/4024/4025/4026/4027/4028/4029/4030/4031/4032/4033/4034/4035/4036/4037/4038/4039/4040/4041/4042/4043/4044/4045/4046/4047/4048/4049/4050/4051/4052/4053/4054/4055/4056/4057/4058/4059/4060/4061/4062/4063/4064/4065/4066/4067/4068/4069/4070/4071/4072/4073/4074/4075/4076/4077/4078/4079/4080/4081/4082/4083/4084/4085/4086/4087/4088/4089/4090/4091/4092/4093/4094/4095/4096/4097/4098/4099/4100/4101/4102/4103/4104/4105/4106/4107/4108/4109/4110/4111/4112/4113/4114/4115/4116/4117/4118/4119/4120/4121/4122/4123/4124/4125/4126/4127/4128/4129/4130/4131/4132/4133/4134/4135/4136/4137/4138/4139/4140/4141/4142/4143/4144/4145/4146/4147/4148/4149/4150/4151/4152/4153/4154/4155/4156/4157/4158/4159/4160/4161/4162/4163/4164/4165/4166/4167/4168/4169/4170/4171/4172/4173/4174/4175/4176/4177/4178/4179/4180/4181/4182/4183/4184/4185/4186/4187/4188/4189/4190/4191/4192/4193/4194/4195/4196/4197/4198/4199/4200/4201/4202/4203/4204/4205/4206/4207/4208/4209/4210/4211/4212/4213/4214/4215/4216/4217/4218/4219/4220/4221/4222/4223/4224/4225/4226/4227/4228/4229/4230/4231/4232/4233/4234/4235/4236/4237/4238/4239/4240/4241/4242/4243/4244/4245/4246/4247/4248/4249/4250/4251/4252/4253/4254/4255/4256/4257/4258/4259/4260/4261/4262/4263/4264/4265/4266/4267/4268/4269/4270/4271/4272/4273/4274/4275/4276/4277/4278/4279/4280/4281/4282/4283/4284/4285/4286/4287/4288/4289/4290/4291/4292/4293/4294/4295/4296/4297/4298/4299/4300/4301/4302/4303/4304/4305/4306/4307/4308/4309/4310/4311/4312/4313/4314/4315/4316/4317/4318/4319/4320/4321/4322/4323/4324/4325/4326/4327/4328/4329/4330/4331/4332/4333/4334/4335/4336/4337/4338/4339/4340/4341/4342/4343/4344/4345/4346/4347/4348/4349/4350/4351/4352/4353/4354/4355/4356/4357/4358/4359/4360/4361/4362/4363/4364/4365/4366/4367/4368/4369/4370/4371/4372/4373/4374/4375/4376/4377/4378/4379/4380/4381/4382/4383/4384/4385/4386/4387/4388/4389/4390/4391/4392/4393/4394/4395/4396/4397/4398/4399/4400/4401/4402/4403/4404/4405/4406/4407/4408/4409/4410/4411/4412/4413/4414/4415/4416/4417/4418/4419/4420/4421/4422/4423/4424/4425/4426/4427/4428/4429/4430/4431/4432/4433/4434/4435/4436/4437/4438/4439/4440/4441/4442/4443/4444/4445/4446/4447/4448/4449/4450/4451/4452/4453/4454/4455/4456/4457/4458/4459/4460/4461/4462/4463/4464/4465/4466/4467/4468/4469/4470/4471/4472/4473/4474/4475/4476/4477/4478/4479/4480/4481/4482/4483/4484/4485/4486/4487/4488/4489/4490/4491/4492/4493/4494/4495/4496/4497/4498/4499/4500/4501/4502/4503/4504/4505/4506/4507/4508/4509/4510/4511/4512/4513/4514/4515/4516/4517/4518/4519/4520/4521/4522/4523/4524/4525/4526/4527/4528/4529/4530/4531/4532/4533/4534/4535/4536/4537/4538/4539/4540/4541/4542/4543/4544/4545/4546/4547/4548/4549/4550/4551/4552/4553/4554/4555/4556/4557/4558/4559/4560/4561/4562/4563/4564/4565/4566/4567/4568/4569/4570/4571/4572/4573/4574/4575/4576/4577/4578/4579/4580/4581/4582/4583/4584/4585/4586/4587/4588/4589/4590/4591/4592/4593/4594/4595/4596/4597/4598/4599/4600/4601/4602/4603/4604/4605/4606/4607/4608/4609/4610/4611/4612/4613/4614/4615/4616/4617/4618/4619/4620/4621/4622/4623/4624/4625/4626/4627/4628/4629/4630/4631/4632/4633/4634/4635/4636/4637/4638/4639/4640/4641/4642/4643/4644/4645/4646/4647/4648/4649/4650/4651/4652/4653/4654/4655/4656/4657/4658/4659/4660/4661/4662/4663/4664/4665/4666/4667/4668/4669/4670/4671/4672/4673/4674/4675/4676/4677/4678/4679/4680/4681/4682/4683/4684/4685/4686/4687/4688/4689/4690/4691/4692/4693/4694/4695/4696/4697/4698/4699/4700/4701/4702/4703/4704/4705/4706/4707/4708/4709/4710/4711/4712/4713/4714/4715/4716/4717/4718/4719/4720/4721/4722/4723/4724/4725/4726/4727/4728/4729/4730/4731/4732/4733/4734/4735/4736/4737/4738/4739/4740/4741/4742/4743/4744/4745/4746/4747/4748/4749/4750/4751/4752/4753/4754/4755/4756/4757/4758/4759/4760/4761/4762/4763/4764/4765/4766/4767/4768/4769/4770/4771/4772/4773/4774/4775/4776/4777/4778/4779/4780/4781/4782/4783/4784/4785/4786/4787/4788/4789/4790/4791/4792/4793/4794/4795/4796/4797/4798/4799/4800/4801/4802/4803/4804/4805/4806/4807/4808/4809/4810/4811/4812/4813/4814/4815/4816/4817/4818/4819/4820/4821/4822/4823/4824/4825/4826/4827/4828/4829/4830/4831/4832/4833/4834/4835/4836/4837/4838/4839/4840/4841/4842/4843/4844/4845/4846/4847/4848/4849/4850/4851/4852/4853/4854/4855/4856/4857/4858/4859/4860/4861/4862/4863/4864/4865/4866/4867/4868/4869/4870/4871/4872/4873/4874/4875/4876/4877/4878/4879/4880/4881/4882/4883/4884/4885/4886/4887/4888/4889/4890/4891/4892/4893/4894/4895/4896/4897/4898/4899/4900/4901/4902/4903/4904/4905/4906/4907/4908/4909/4910/4911/4912/4913/4914/4915/4916/4917/4918/4919/4920/4921/4922/4923/4924/4925/4926/4927/4928/4929/4930/4931/4932/4933/4934/4935/4936/4937/4938/4939/4940/4941/4942/4943/4944/4945/4946/4947/4948/4949/4950/4951/4952/4953/4954/4955/4956/4957/4958/4959/4960/4961/4962/4963/4964/4965/4966/4967/4968/4969/4970/4971/4972/4973/4974/4975/4976/4977/4978/4979/4980/4981/4982/4983/4984/4985/4986/4987/4988/4989/4990/4991/4992/4993/4994/4995/4996/4997/4998/4999/5000/5001/5002/5003/5004/5005/5006/5007/5008/5009/5010/5011/5012/5013/5014/5015/5016/5017/5018/5019/5020/5021/5022/5023/5024/5025/5026/5027/5028/5029/5030/5031/5032/5033/5034/5035/5036/5037/5038/5039/5040/5041/5042/5043/5044/5045/5046/5047/5048/5049/5050/5051/5052/5053/5054/5055/5056/5057/5058/5059/5060/5061/5062/5063/5064/5065/5066/5067/5068/5069/5070/5071/5072/5073/5074/5075/5076/5077/5078/5079/5080/5081/5082/5083/5084/5085/5086/5087/5088/5089/5090/5091/5092/5093/5094/5095/5096/5097/5098/5099/5100/5101/5102/5103/5104/5105/5106/5107/5108/5109/5110/5111/5112/5113/5114/5115/5116/5117/5118/5119/5120/5121/5122/5123/5124/5125/5126/5127/5128/5129/5130/5131/5132/5133/5134/5135/5136/5137/5138/5139/5140/5141/5142/5143/5144/5145/5146/5147/5148/5149/5150/5151/5152/5153/5154/5155/5156/5157/5158/5159/5160/5161/5162/5163/5164/5165/5166/5167/5168/5169/5170/5171/5172/5173/5174/5175/5176/5177/5178/5179/5180/5181/5182/5183/5184/5185/5186/5187/5188/5189/5190/5191/5192/5193/5194/5195/5196/5197/5198/5199/5200/5201/5202/5203/5204/5205/5206/5207/5208/5209/5210/5211/5212/5213/5214/5215/5216/5217/5218/5219/5220/5221/5222/5223/5224/5225/5226/5227/5228/5229/5230/5231/5232/5233/5234/5235/5236/5237/5238/5239/5240/5241/5242/5243/5244/5245/5246/5247/5248/5249/5250/5251/5252/5253/5254/5255/5256/5257/5258/5259/5260/5261/5262/5263/5264/5265/5266/5267/5268/5269/5270/5271/5272/5273/5274/5275/5276/5277/5278/5279/5280/5281/5282/5283/5284/5285/5286/5287/5288/5289/5290/5291/5292/5293/5294/